



PU-1601100202040402

Seat No. \_\_\_\_\_

M. A. (Sem. IV) (CBCS) Examination

August - 2020

Sanskrit : ECT- 05

(Vedantshastra)

(Shribhashya & Anubhashya on Brahmsutra)

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

સૂચના / Instructions :

(૧) આ પ્રશ્નપત્રમાં કુલ પાંચ પ્રશ્નો છે.

(1) This question paper carry five questions.

(૨) માર્ક્સ સામે લખેલા છે.

(2) Marks indicates against.

૧ (અ) નીચેનામાંથી કોઈપણ બે પરિચ્છેદોનો અનુવાદ કરો : ૧૦

1 (a) Translate any **two** paragraphs from the following : 10

(૧) તેન પૂર્વપદદ્વયવ્યાવૃત્તકોટિદ્વયવિલક્ષણાઃ સાતિશયસ્વરૂપસ્વગુણા નિત્યા વ્યાવૃત્તાઃ, વિશેષણાનાં વ્યાવર્તકત્વાત્। તતઃ ‘સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ’ (તૈ ૨/૧/૧) ઇત્યનેન વાક્યેન જગજ્જન્માદિનાવગતસ્વરૂપં બ્રહ્મ સકલેતરવસ્તુવિસજાતીયમિતિ લક્ષ્યત ઇતિ—નાન્યોન્યાશ્રયણમ્। અતઃ સકલજગજ્જન્માદિકારણનિરવઘં સર્વજ્ઞં સત્યસંકલ્પં સર્વશક્તિ બ્રહ્મ લક્ષણતઃ પ્રતિપત્તું શક્યત। – ઇતિ સિદ્ધમ્।

(૨) અન્યત્રાપિ સાવયત્વાદિના કાર્યત્વં જ્ઞાતમિતિ તે ચ પ્રતિપન્ને એવેતિ ન કશ્ચિદવિશેષઃ તથા હિ ઘટમણિકાદિષુ કૃતેષુ કાર્યત્વદર્શનાનુમિતકર્તૃગ— તતન્નિર્માણશક્તિજ્ઞાનઃ પુરુષોઽદૃષ્ટપૂર્વ વિચિત્રસંનિવેશં નરેન્દ્રભવનમાલોક્ય— સાવયવસંનિવેશવિશેષેણ તસ્ય કાર્યત્વં નિશ્ચિત્ય તદાનીમેવ કર્તુસ્તજ્ઞાન— શક્તિવૈચિત્ર્યમનુમિનોતિ। અતસ્તનુભુવનાદેઃ કાર્યત્વે સિદ્ધે સર્વસાક્ષાત્કાર— તસ્નિર્માણાદિનિપુણઃ કશ્ચિતપુરુષવિશેષઃ સિદ્ધ્યત્યેવ।

(३) अथोच्यते रज्जुरेषा न सर्प इत्युपदेशेनसर्पभयनिवृत्तिदर्शनाद्रज्जु-  
सर्पवदबन्धस्य च मिथ्यारूपत्वेन ज्ञानबाध्यतया तस्य वाक्यजन्यज्ञानमैव  
निवृत्तिर्युक्ता न नियोगेन। नियोग साध्यत्वे मोक्षस्यानित्यत्वं स्यात्-  
स्वर्गादिवत्। मोक्षस्य नित्यत्वं हि सर्ववादिसंप्रतिपन्नम्।

(४) तत्र प्रतिपद्यते-तत्तु समन्वयादिति। समन्वयः सम्यगन्वयः। पुरुषार्थतयान्वय  
इत्यर्थः। परमपुरुषार्थभूतस्यानवधिकातिशयानन्दस्वरूपस्य ब्रह्मणोऽभिधेया-  
न्वयान्यात्तच्छास्त्रप्रमाणत्वं सिध्यत्येवेत्यर्थः। निरस्तनिखिलदण्डगन्धनिरति-  
शयानन्दस्वरूपतया परमप्राप्यं ब्रह्म बोधयन्वेदान्तवाक्यगणः।

(अ) नीचेनामांथी कोईपक्ष अके परिच्छेदनो अनुवाद करो : ४

(b) Translate any singal paragraph from the following : 4

(१) न विद्यते शब्दो यत्रेत्यशब्दं सर्ववेदान्तप्रतिपाद्यं ब्रह्म भवति। कुतः। ईक्षते।  
'सदेव सौम्येदमग्र आसीदेकमेवाद्वितीय' मित्युपक्रम्य 'तदैक्षत  
बहुस्याम्प्रजायेयेति'। 'तत्तेजोसृजत'। तथान्यत्र आत्मा वा इदमेक एवाग्र  
आसीत् नान्यत् किञ्चनमिषत् स ऐक्षत लोकान्नु सृजा इति इमान  
लोकानसृजतेति।

(२) ईक्षत्यादिकं तु प्रकृतिगुणसम्बन्धादपि ब्रह्मणो युज्यते। तस्मादलौकिकसर्व-  
भवनसमर्थत्वादिकल्पनापेक्षया लौकिक एवान्यतरबाधो युक्तः। ततश्च  
सत्यस्वरूपादन्यदेवैतदिति स्वयमेवाशङ्क्य परिहरति सूत्रकारः।

२ रामानुजाचार्ये प्रदत्त चतुःसूत्रीचिंतनो चितार आपो. १४

2 Describe चतुःसूत्रीचिन्तन of Ramanujacharya. 14

अथवा / OR

२ तत्त्वदर्शनपरंपरायां आचार्यवल्लभं वैशिष्ट्यं निरूपो. १४

2 Describe the specialities of Vallbhacharya in the tradition of Philosophy. 14

३ कोईपक्ष के विशेषों लखो : १४

3 Write a note on any two : 14

(१) आचार्यरामानुजनुं कर्तृत्व.

(1) Kartruttva of Ramanujacharya.

(२) श्रीभाष्यानुसारं ब्रह्मतत्त्वमीमांसा.

(2) Thoughts of ब्रह्मतत्त्व according to Shribhashya.

(३) शुद्धाद्वैतानुसारं "जन्माद्यस्य यतः" सूत्रनुं दर्शन.

(3) "जन्माद्यस्य यतः" Sutradarshan according to शुद्धाद्वैत।

(४) भाष्यकार रामानुजना मत प्रमाणे प्रमाणविचार.

(4) प्रमाणविचारः according to Shribhashyakar.

- ४ नीयेनामांथी कोरुपशु डे डर डूरुडर संदरुडु सडुडरुवु. १ॡ
- 4 Explain with reference any **two** of the following : 14
- (1) ँकसुडनुनेव वलशुषणरुनरुडुडसंहरुः।
- (2) ननु शरुसुतडुुनलतुवुं डुरहुडणः न सडुडवतल।
- (3) न वेदरुनुतवरुकुडरुनल डुरहुड डुरतलडरुदडनुतल।
- (4) अडरुधलतुं ँव डुरतुडडः सरुवतुररुथ वुडवसुथरुडडतल।
- ॡ (अ) कोरुपशु अक वलशु नुंध लडुु : ७
- 5 (a) Write a note on any **singal** : 7
- (१) वलुलडरुडरुडरुनुसरु 'डरलशुडरुडरुद' डर वलवेडन.
- (1) According to Vallbhacharya thoughts of 'परलणरुडरुद'।
- (२) अशुडरुडरुडरुनल डत डुरडरुशु कुवनुं रुड.
- (2) According to डुवरुडडु Anubhashyakar.
- (ड) नीयेनामांथी कोरुपशु अक डर डूरुडरु संदरुडु सडुडरुवु : ७
- (b) Explain with reference any singal of the following : 7
- (1) इतुडेवडरुडलषु सुषुठलवरुकुडेषु डुरहुडण ईकुषरु डुरतुडडते।
- (2) कुरुतुवडकुरुतुवतुवुं क वेदे डुरतुडडते डुरहुडणः।